

WWW.ECONOMICTIMES.COM



Anti-profiteering Authority can act against organised players as they're the ones who decide MRP. We don't want that industry should suffer. But, at the same time, consumers should also not suffer

Companies have to Ensure Distribution Chains Pass on GST Cuts to Consumers

goods and services tax to consumers, says finance secretary Hasmukh Adhia. In an interview to **Deepshikha Sikarwar**, he said companies will have to respond to Anti-Profiteering Authority if trade does not pass on the tax cuts. Edited excerpts:

Lately, a lot of concerns were raised about the management of the Indian economy. Do you think the Moody's upgrade answers this criticism?

International agencies have recognised and understood the long-term strategies of this government that would benefit the economy in the long run.

India, in the past three years, has been the fastest-growing economy in the world. Our macroeconomic fundamentals remain robust. Inflation has been checked. Fiscal deficit that stood at more than 6% of GDP in 2008-09 will, as per this year's target, be 3.2% of GDP. India's tax-to-GDP [ratio] compared to other countries is lower. The government has taken steps that will bring down tax evasion in the long run. These steps have improved tax buoyancy. Structural reforms such as the GST (goods and services tax) will not just give a boost to indirect taxes but also direct taxes. In the last three years, a lot of work has been done in this country. To an extent, this upgrade is an endorsement of government's policies. This will make the country more attractive to foreign capital. It will make overseas borrowing cheaper for Indian companies.

GST TRENDS

Once govt has GST revenue trends for 1-2 more months. it will be able to make an estimate for the current year and formulate the budget

There is some uncertainty around GST collections and analysts see pressure on

Everyone knows GST is a huge structural

reform. Whenever there is any new measure, people take time to adapt. There were some initial issues with compliances addressed, GST compliance will improve. In the long term, this would have its impact. Tax buoyancy, going forward, would see a huge improvement. In the next one-two years, we should reap the benefits of GST. We have revenues trends for three months. Once we have the trend for one or two months more, we will be able to arrive at an estimate for the current year. So, we will have clarity by the time we formulate the budget. We will know if there is going to be a shortfall as per budget estimate for revenues. We are closely watching the GST trends.

There have been lot of changes to the GST framework since the rollout? Do you think the tax has now settled?

In the last two months, 90% of the problems based on the feedback we got have been resolved. There were two types of issues: one was related to compliance, the other to rate. Some of the items manufactured by SMEs were also placed in higher tax bracket based on earlier tax incidence. So, there was discontent. We have corrected that situation. These changes will not cause any major setback to revenues. Hopefully, we have been able to address most of the issues, so [we] won't have to make changes for another three months. If some issue comes up, then keeping in view the revenue trends,

There have been demands for inclusion of real estate and petroleum into GST...

When you have GST, then all sectors of the economy should be covered. If we have to have a perfect GST, we will have to include all sectors. Outside the [GST] Council, there may be demands, but within the council, rational decisions are taken after taking all aspects into account, Rational decision, in this case, would mean that until the revenue trends do not settle down, states would not want to part with revenues from the petroleum sector. We would be happy if these are included.

There have also been demands for further rationalisation in slabs?

We should move in the direction of two slabs. But this immediately would be regressive as some items would have to



MOODY'S RATING

The upgrade is an endorsement of government's policies in last 3 years. It'll make the country more attractive to foreign capital and make overseas borrowing cheaper for Indian companies

be moved from 5% to higher tax rate. At present, we have household common use items at 5%. The 5 % has edible oil, sugar. If we raise these to 12%, the poor will be hit immediately. If we want to move in the direction of two slabs, we need to resist the temptation or demands for bringing any item from 12% to 5% as raising them again would be difficult.

GST rate for restaurants was cut to 5%. What kind of signal is the GST Council trying to send?

When we decided the rate for the restaurant sector, we kept it at 12 % for non-AC and 18% for AC. We assumed the credit that it gets in lieu of taxes paid on input uses and reduce menu price. Some restaurant chains indeed cut their menu price, but some did not. The country has over three lakh restaurants, so it's difficult to check if each one has passed on the benefit or not.

We received maximum complaints under anti-profiteering against restaurants and real estate. Complaints against restaurants was that they straightaway levied 18% on menu price without any change in the menu price. Consumers did not find this palatable. We then looked into the issue. Some restaurants had to pay substantial commercial rent and could claim input credit for the tax paid but some did not have large input tax credit as most items such as food items consumed by them are exempt. That's why the council thought that input credit should not be allowed, but tax rate should be cut. This would mean that customer would have to pay lesser tax. If restaurants increase menu price, competition will take care of that. With this step, not much anti-profiteering action would be required for this sector.

There are concerns in the industry over the functioning of Anti-profiteering Authority? Industry need not worry about the

functioning of the authority. It would not go after frivolous, small complaints. If there is a complaint against a big organised sector player, then it will come into picture.

GST Council has cut tax on 178 items to 18% from 28%. But, at retail level, consumers have not felt a substantial change...

It is necessary for a retailer to pass on the tax cuts. It should be clearly understood that MRP includes all taxes. If a good has old MRP, which was on basis of 28% tax, then the rate should come down automatically. This is responsibility of the company. Company has to ensure that their entire distribution chain wholesalers, retailers – pass on this tax cut. I would like to appeal to FMCG companies that if they want to escape action from the Anti-profiteering Authority, they should ensure that this tax cut is passed to consumers. This argument

INDIRA IVF

wholesaler cannot hold. A retailer when he sells to a consumer should charge only 18%. He will be able to get refund of any additional tax he may have paid to the wholesaler or input tax credit. Consumers also need to be conscious as taxes have been cut on so many products of mass consumption such as washing powder The Consumer Affairs Ministry has given

CHANGING TAX SLABS

If we want to move in the direction of two slabs, we need to resist the temptation for bringing any item from 12% to 5% as raising them again would be difficult

orders to paste new stickers by December for goods sold on MRP. But price revision should have happened immediately. I would request all FMCG companies to declare transparently in newspapers what was the MRP of their products earlier and after the revision.

An FMCG company directs its trade to pass on the benefit, but trade does not. Who will be held liable under anti-profiteering law? It is the company's responsibility to

ensure that its entire retail chain follows its directives on pricing. If a trader is not selling a good at revised MRP, then it is the responsibility of the company. It will have to respond to the Anti-Profiteering Authority on this. Action can only be taken against organised players as they are the ones who decide MRP. We don't want that industry should suffer. But, at the same time, consumers should also not suffer. Will the authority also act if the consumer is a large company with a large number of suppliers? This is a subject of mutual negotiations. This provision is for the common man who is powerless.

Going forward, will we see some action on direct taxes?

In 2015, we gave a timetable for phase-out of all exemptions. We have been following that timetable and have stayed firm on it.

GULSHAN KUMAR PRESENTS AN ELLIPSIS ENTERTAINMENT PRODUCTION

MOODY'S UPGRADE

Green Cos Expect Easier Financing

Nishtha.Saluja@timesgroup.com

 $\textbf{New Delhi:} India \verb"s" rapidly growing renewable$ energy projects will gain from easier finance for investments following the upgrade of the country's sovereign rating by Moody's, industry leaders said. But the good news may be overshadowed by regulatory woes stifling the sector.

"Moody's upgrade of India to a solid investment grade level is a positive and significant move. This will especially be beneficial for the renewable energy sector where sectoral lending options for domestic financial institutions and banks are limited and interest costs are an important part of the project cost," said Sumant Sinha, chairman and CEO of ReNew Power.

For multinationals such as Sembcorp, India is an important market, and they have been evincing their interest in the country's clean energy sector by increasing investments over the past year. "The upgrade reflects the growing impact of India's economic and institutional reforms. This should have dual benefits for industry: first, a lower cost of capital will make Indian industry more competitive. Se-

cond, global endorsement may encourage the government to continue its bold reforms, especially in areas like power," said Vipul Tuli, CEO & country head of Sembcorp India.

however cautious of policy hurdles. especially on renegotiation of PPAs

In August this year, Sembcorp acquired 100% stake in its renewable energy business Sembcorp Green Infra in a bid to expand its presence in the country. On November 17, US-based Moody's Investors Service improved India's sovereign credit rating to 'Baa2'.

citing important economic policy measures including the Goods and Services Tax (GST) and bankruptcy law, which will help reduce the borrowing cost for Indian companies and improve global investors' outlook towards India.


REGULATORY HURDLES REMAIN

With the Indian government's aggressive push for renewables, the industry remains positive of the potential of the sector. However, it is also cautious of various policy hurdles, especially relating to renegotiation of power purchase agreements (PPAs), among other things.

While an improvement in India's credit rating is a "big positive" for the renewable energy sector, which is heavily reliant on global capital, regulatory and commercial challenges may overshadow this development, said Kameswara Rao, leader-energy, utilities and mining at PwC India. "The uptick in renewable energy M&A deals is a clear sign of how difficult it has become to pursue greenfield projects. Investors are paying a premium to overcome this regulatory uncertainty," he added.

Investors are bullish on the sector despite the challenges but at the same time maintain that government should be able to translate this positive development on the ground by ensuring the sustainability of the energy mix in India.

SSI Daman Branch, Centre Point Building, Near Somnath Crossing, Dabhel, Daman.



The undersigned being the Authorized Officer of the Bank of Baroda unde the Securitization and Reconstruction of Financial Assets and Enforcement o Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Sectior 13 read with the Security Interest (Enforcement) Rules, 2002, issued demand M/s. F W Team, Mr. Nimish Hakani, Mrs. Jyotsna Hakani, Mr. Hetal Hakani Mr. Vasant hakani, and Mr. Krutarth D Goradia to repay the amoun mentioned in the notice being Rs. 1,85,91,820.45(Rupees One Crore Eighty Five Lacs and Ninety One Thousand Eight Hundred Twenty and Paisa Fourty Five Only) as on 31.07.2017 with further interest and expenses within 60 days

from the date of notice/date of receipt of the said notice.
The Borrowers / Guarantor / Mortgagor having failed to repay the amount notice is hereby given to the Borrowers / Guarantor / Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 16th day of November of the year 2017. The Borrowers / Guarantor / Mortgagor in particular and the public in genera

is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount o Rs. 185,91,820.45 as on 31.07.2017 and interest & expenses thereon unt the full payment.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

DESCRIPTION OF MOVABLE PROPERTY All that parts and parcel of the property of land and building M/s Hightech Industries consisting of industrial land and building property situated at Plot No. 35, Sr. No. 653/1(35), Somnath Industria coopretive Society, Dabhel, Nani Daman, Daman admeasuring area of land 800.00 Sq. mtrs and boundaries as follow: East : By Plot No. 36, West : By Internal Road, North: By Internal Road South: By Plot No. 34

PROPERTYNO.2)

All that part and parcel of the property of Mrs. Jyotsna
Vasant Hakani and Mr. Vasant P Hakani consisting of residential property situated Flat no. 604, 6th Floor, Royal Twins Co-Operative Housing Society Limited, Part-II, Sr. No. 861/91, Village Chala, Vapi- Daman main Road, Vapi Valsad, Gujarat.

DEBTS RECOVERY TRIBUNAL-II

3rd Floor, Bhikhubhai Chamber, Near Kocharab Ashram, Paldi Ahmedabad - 380006. Ph. 079-26579343, Tele Fax: 079-26579343

FORM NO. 14 (See Regulation 33(2))

DEMAND NOTICE

for self and Sole Proprietor of M/s National Impex, Residing at B-103

Residing at: Plot No. 4, Bhavna Society, Lalita Chokdi, Katargam

(CD s No. 3 & 4 Residing at) Plot No. 62, Amipark Society, Opp

In view of the Recovery Certificate issued in O.A. No. 301/2015

passed by the Hon'ble Presiding Officer, DRT-II, Ahmedabad an amount of Rs.

22,14,910.00 (Rs. Twenty two lacs fourteen thousand nine hundred ten only

You are hereby called upon to deposit the above sum within 15 days of the

(b) All costs, charges and expenses incurred in respect of the service of this

notice and other process that may be taken for recovering the amount due.

receipt of the notice, failing which the recovery shall be made as per rules

(a) Such interest & Cost as is payable in terms of Recovery Certificate

Chandra Kiran Apartment, Khodiyar Nagar Road, Varachha, Surat.

Mr. Vipulkumar Shantilal Ujainiya & Others

C. D. No. 1: Mr. Vipulkumar Shantilal Ujainiya

C. D. No. 3: Mr. Kaushik Vinubhai Lakhani

C. D. No. 4: Mr. Vinubhai Kanjibhai Lakhani

Surat

is due against you.

C. D. No. 2: Mr. Alpeshkumar Ghaynshyambhai Miyani

Shivnagar, Puna - Simada, Surat.

In additions to the sum aforesaid you will be liable to pay:

Given under my hand and seal of the

Tribunal, this 16/11/2017

Next Date: 03-01-2018

Date: 16/11/2017

Dena Bank

... Certificate Holder Bank

Sd/-(Jai Singh) Recovery Officer-II DRT-II, Ahmedabad

...Certificate Debtors

ADF Foods Limited

CIN: L15400GJ1990PLC014265 Regd. Office: 83/86 GIDC Industrial Estate, Nadiad 387001, Gujarat Tel.: 0268-2551381/2 Fax.: 0268-2565068; E-mail: info@adf-foods.com; website: www.adf-foods.com

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held in Mumbai on Tuesday 28th November, 2017 at 11.00 a.m., inter alia, to consider and approve the Un-audited Financial Results of the Company for the second guarter and half year ended 30th September, 2017.

The said notice may be accessed on the Company's website at www.adf-foods.com and may be accessed at BSE website at www.bseindia.com and at NSE website at www.nseindia.com.

For ADF Foods Ltd.

20th November, 2017

Bimal R. Thakkar **Managing Director** DIN: 00087404

बैंक ऑफ़ इंडिया Bank of India Vatva Branch - Ahmedabad - 382440 Tele - No. 9978986911, 9978986912, 997898691

Ref. No. AO/SARFAESI/17-18/13

Date: 07.10.2017

Mr. Sanjaybhai Mohanbhai Patel, F/104, Krish Residency No. 2, Opposite Krisl esidency No. 1, B/H Uma School, Vatva, Ahmedabad - 382440. Mrs. Nimisha Sanjaybhai Patel, F/104, Krish Residency No. 2, Opposite Krish Residency No. 1, B/H Uma School, Vatva, Ahmedabad - 382440.

Sir, NOTICE U/S 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 At the request made by you, the Bank has granted to you various credit facilities aggregating to an amount of Rs. 23,00,000/- .We give hereunder details of various credit

facilities granted by us and the outstanding dues thereunder as on the date of notice. Nature of Facility (a) Home Loan (2) Sanctioned Limit Rs. 23,00,000/- Outstanding Dues Rs. 23,91,644/-The aforesaid credit facilities granted by the Bank are secured by the following Assets/Securities (Particulars of properties/Assets charged to Bank):a. EQM of property situated at Flat No. B-501, 5th floor, scheme of Shajanand Residency lying at Mouje Nikol District Ahmedabad

As you have defaulted in repayment of your dues to the Bank under the said credit facilities we have classified your account as Non-Performing Asset with effect from 30.09.2017 in accordance with the directions/guidelines issued by the Reserve Bank of India.

For the reasons stated above, we hereby give you notice under Section 13(2) of the above noted Act and call upon you to discharge in full your liabilities by paying to the bank sum o Rs. 23,91,644 (contractual dues upto the date of notice) with further interest thereon@ 9.25% p.a. compounded with monthly rests, and all costs charges and expenses incurred by the Bank, till repayment by you within a period of 60 days from the date of this notice, failing which please note that we will entirely at your risks as to costs and consequence exercise the powers vested with the Bank under Section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, agains the secured assets mentioned above.

While we call upon to discharge your liability as above by payment of the entire dues to the Bank together with applicable interest, all costs, charges and expenses incurred by the bank till repayment and redeem the secured assets within the period mentioned above please take important note that as per section 13(8) of the SARFAESI Act, the right or redemption of secured assets will be available to you only till the date of publication or notice for public auction or inviting quotations or tender from public or private treaty for transfer by way of lease, assignment or sale of the secured assets.

in payment of all costs, charges and expenses which are incurred by us and/or any expenses incidental thereto, and secondly in discharge of the Bank's dues as mentioned above with contractual interest from the date of this notice till the date of actual realization and the residue of the money, if any, after the Bank's entire dues (including under any o your other dues to the Bank whether as borrower or guarantor) are fully recovered, shall be If the said dues are not fully recovered from the proceeds realized in the course of exercis of the said powers against the secured assets, we reserve our right to proceed against you and your other assets including by filing legal/recovery actions before Debts Recover Tribunal/Courts, for Recovery of the balance amount due along with all costs etc. incidenta

The amounts realized from exercising the powers mentioned above, will firstly be applied

thereto from you. Please take note that as per Sub-section (13) of the aforesaid Act, after receipt of this notice, you are restrained from transferring or creating any encumbrances on the aforesai secured assets whether by way of sale, lease, licence, gift, mortgage or otherwise. The undersigned is a duly authorised officer of the Bank to issue this notice and exercise

power under Section 13 of aforesaid Act. . Needless to mention that this notice is addressed to you without prejudice to any other

Date: 07-10-2017 Place: Ahmedabad

Yours faithfully, (Sumer Navla) - AUTHORISED OFFICE

VIDYA BALAN Take your First Step to **MOTHERHOOD** Celebrates
HAPPY FAMILY with tumhari Sulu

INDIRA IVF HOSPITAL PVT. LTD.

4th Floor, ABC-2, St. Xavier's College Corner, Off C.G. Road, Navrangpura, Ahmedabad Helpline: 07665009964 / 65, E-mail: info@indiraivf.in, Website: www.indiraivf.com

UDAIPUR | PUNE | DELHI (PATEL NAGAR, ROHINI, LAJPAT NAGAR) | PATNA | JAIPUR | INDORE AHMEDABAD | LUCKNOW | NAGPUR | MEERUT | MAU | AGRA | NASHIK | KOLKATA | BENGALURU CHENNAI | VARANASI | ALLAHABAD | RANCHI | FARIDABAD | KANPUR | GORAKHPUR | HYDERABAD MUZAFFARPUR | BHUBANESHWAR | MUMBAI (BORIVALI, VASHI) | BHAGALPUR | DEHRADUN

fb.com/MoviePartnerships

Prenatal Sex Determination & Sex Selection is illegal and not done here

Fastest Growing IVF Chain in INDIA

દેશની બીજા ક્રમની સૌથી મોટી બેટરી

ઉત્પાદક અમરા રાજાએ વોલ્યુમ ગ્રોથમાં સાતત્થ અને મજબૂત ઓપરેટિંગ માર્જિન નોંધાવ્યા બાદ રસ વધ્યો છે. 🌬

સેન્સેક્સમાં બેન્ક શેરોનું વેઇટેજ વધશે

બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં આગામી મહિનાથી થનારા ફેરફારની સીધી અસર સેન્સેક્સ પર વધતી જશે. >>10



બજારમાં તેજીનો ટ્રેન્ડ મર્ચાદિત રહેવાની ધારણા

हीवाह डी તેજી-મંદીની આંટીઘૂંટી

Baa2 કર્યું હતું. રેટિંગમાં વધારો ૧૪ મજબૂત છે. વર્ષ બાદ થયો છે, જેનાથી ઇક્વિટી અને બોન્ડ માર્કેટ્સમાં વધુ વિદેશી મજબૂતાઈને કારણે આઇટી અને નાણાપ્રવાહ આવી શકે છે. શુક્રવારે ફાર્મા ઇન્ડેક્સમાં વધુ ઘટાડો થઈ શકે રેટિંગ અપગ્રેડ બાદ નિફ્ટી અને છે. તેથી આ બંને ક્ષેત્રોના શેરો અને સેન્સેક્સ બંને ગેપ-અપમાં ખૂલ્યા મેટલ શેરોથી દૂર રહેવું વધુ યોગ્ય છે. હતા, પરંતુ વૈશ્વિક બજારના નેગેટિવ ગયા સપ્તાહે મેટલ શેરોમાં કરેક્શન સંકેતને કારણે મોટા ભાગનો ઉછાળો આવ્યું હતું, પરંતુ ઓવરસોલ્ડ ધોવાઈ ગયો હતો. ભારતનો રૂપિયો પોઝિશનને કારણે શુક્રવારે કરેક્શન પણ મજબૂત સ્તરે ખૂલ્યો હતો અને આવ્યું હતું. મુખ્ય ટેક્નિકલ ઇન્ડિકેટર્સ ૧૦ વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ ૧૦ બેસિસ પોઇન્ટ્સ ગબડી હતી.

નિફ્ટી ૧૦,૨૫૦થી ઉપર ૧૦,૨૮૩એ બંધ આવ્યો હતો, જે પોઝિટિવ છે, પરંતુ ટેક્નિકલ કારણો અને નકારાત્મક વૈશ્વિક સંકેતને છે. આ બંને સ્તરથી નીચે જશે તો તે ક્રૂડ ઓઇલમાં પોઝિટિવ વલણ ૧૦,૦૦૦થી નીચે જઈ શકે છે.

અને ૨૩,૫૯૯એ અવરોધ છે. તેનાથી અને ૫૪.૨૬ ડોલરે સપોર્ટ છે. નીચે કે ઊંચે જશે તો તે બજારની દિશા બોન્ડની યીલ્ડમાં ઘટાડો અને સાવચેતી રાખવી જોઈએ.

છે, તેમાં તેજીનું આઉટલૂક છે, પરંતુ અપસાઇડ મર્યાદિત લાગે છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ઓવરબોટ છે, તેથી આપશે તીવ્ર અપસાઇડની એક આશ્ચર્યજનક હિલચાલમાં અપેક્ષા રાખવી જોઈએ નહીં. જોકે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના નિક્ટી પ્રાઇવેટ સેક્ટર બેન્ક ઇન્ડેક્સ સોવરિને રેટિંગને Baa3થી વધારીને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ કરતાં વધુ

અમેરિકાના ડોલર સામે રૂપિયામાં હજુ નબળા છે, તેથી માત્ર

> એલેક્સ મેથ્યુ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ, સ્થાપક nedailybrunch.com

પસંદગીના શેરો બજારમાં

સારો દેખાવ કરી શકે છે. ભારતના બજાર માટેના કારણે અપસાઇડ મર્યાદિત છે. મુખ્ય આર્થિક ડેટામાં બેન્ક લોન નિફ્ટીમાં તાકીદનો અવરોધ ૧૦,૩૪૧ ગ્રોથ, ડિપોઝિટ ગ્રોથ અને વિદેશી અને ૧૦,૩૯૦એ છે. જો આ સપ્તાહે હુંડિયામણની અનામતનો સમાવેશ આ બંને સપાટી વટાવી જશે તો તે થાય છે. અમેરિકાના બજાર માટેના ૧૦,૪૯૨ને સ્પર્શ કરી શકે છે, પરંતુ મુખ્ય આર્થિક ડેટામાં જોબલેસ ક્લેમ, તેની શક્યતા મર્યાદિત છે. નિફ્ટીમાં ગેસોલિન સ્ટોક અને યુએસ FO-૧૦,૨૫૬ અને ૧૦,૧૨૧એ સપોર્ટ MCની કાર્યનોંધનો સમાવેશ થાય છે.

છે, પરંતુ ઇરાક અને તુર્કીએ નિકાસ અમેરિકામાં સૌથી મોટું જોખમ કરવાનો નિર્ણય કર્યા બાદ ગુરુવારે બોન્ડમાં તીવ્ર ઘટાડો છે, જેને ઇક્વિટી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. માર્કેટમાં ટેક્નિકલ કરેક્શનનો ટેક્નિકલ દેષ્ટિએ જોઈએ તો ક્રૂડ પ્રારંભિક સંકેત માનવામાં આવે છે. ડાઉ ઓઇલ બેરલ દીઠ ૫૮ ડોલર થઈ શકે જોન્સમાં ૨૩,૨૬૪એ મજબૂત સપોર્ટ છે. તેમાં બેરલ દીઠ ૫૫.૦૪ ડોલર

આપી શકે છે. ડાઉ જોન્સનો મન્થલી આગામી મહિને ફેડરલ રિઝર્વની આરએસઆઇ ૮૦થી ઉપર છે, તેથી બેઠક પહેલાં ડોલરમાં નરમાઈને ઊંચા સ્તરે લોંગ પોઝિશન લેતી વખતે કારણે સોનામાં ફરી પોઝિટિવ વલણ છે. સોનામાં ઔંસ દીઠ ૧,૨૭૮ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં ૨૫,૩૬૮એ અને ૧,૨૬૮ ડોલરે સપોર્ટ છે. તેમાં સપોર્ટ અને ૨૬,૦૦૯એ અવરોધ ૧,૩૦૫એ અવરોધ છે.

સ્પષ્ટતાઃ આ કોલમમાં થતી આર્થિક સમીક્ષા, બજાર વિશ્લેષણ અને શેર સમીક્ષા સબધિત બજાર વિશ્લેષક દ્વારા શેરબજાર અગે પ્રાપ્ય માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે. બજારમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારે રોકાણનો કોઈ पण निर्णय पोतानी समक्षण अने निष्णांतना मार्गदर्शनने आधारे हरवानो રહેશે. રોકાણકારને પોતાના નિર્ણયથી થનારા લાભ કે નુકસાન માટે ઇકોનોમિક ટાઇમ્સ અને લેખક/એનાલિસ્ટ કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.

SBI જનરલના 18થી 24 મહિનામાં લિસ્ટિંગની હિલચાલ

શિલ્પી સિંહા મુંબઈ

સરકાર જાહેર ક્ષેત્રની બેન્કો માટે રિકેપિટલાઇઝેશન યોજના તૈયાર કરી રહી છે ત્યારે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના મૂડીઆધારને સુધારવા માટે આગામી ૧૮થી ૨૪ મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયન જૂથ (આઇએજી) સાથેના સંયુક્ત સાહસ એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સનું લિસ્ટિંગ કરાવવા માટે વિચારી શકે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેની જનરલ સંયુક્ત સાહસના એમઓયુમાં દર્શાવ્યા ઇન્શ્યોરન્સ પેટાકંપનીમાં ૨૦ ટકા અનુસાર ચોક્કસ સમય મર્યાદાની અંદર હિસ્સાનું વેચાણ કરીને ₹૨,૫૦૦ કરોડ કોલની કવાયત કરવાનો અધિકાર છે, એકત્ર કરી શકે. તેણે પોતાની જીવન જેને આઇએજીએ કેટલાક મહિના અગાઉ વીમા પેટાકંપની એસબીઆઇ લાઇફમાં પાર પાડ્યો હતો. તેનો આઠ ટકા હિસ્સો વેચીને ₹૫,૬૦૦ ₹૬૫,૯૭૫ કરોડ મુકાયું છે.

અને દેખાવમાં સુધારામાં પરિણમશે.

તેમનો હિસ્સો ૪૯ ટકા સુધી લઈ જવાની ગણાએ છે.



હાલના દેખાવના આધારે જોઈએ તો તક મળે છે. ડાયલ-અપ ઓપ્શને તેના


સંયુક્ત સાહસમાં પ્રવેશ કરતી કરોડ એકત્ર કર્યા છે. કંપનીનું મૂલ્ય વખતે આઇએજીએ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં એસબીઆઇના ભાગીદાર એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સના બનવા માટે ૨૬ ટકા હિસ્સો હસ્તગત એમડી અને સીઇઓ પુશન મહાપાત્રાએ કરવા માટે ₹૫૪૨ કરોડ ચૂકવ્યા જણાવ્યું હતું કે, લિસ્ટિંગ મૂડીની હતા. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરી આઇએજીનો હિસ્સો વધીને ૪૯ ટકા શકે કેમ કે અમે ઝડપી ગતિએ વૃદ્ધિ થાય તો આઇપીઓ મારફત હિસ્સાનું કરી રહ્યા છીએ. તે શેરહોલ્ડર્સને તેમના વેચાણ સપ્રમાણ ભાગમાં થશે. જનરલ રોકાશનાં નાશાં મેળવવામાં મદદ કરશે ઇન્શ્યોરન્સ કંપનીઓનું વેલ્યુએશન તથા વધારે સારા ડિસ્ક્લોઝર, ગવર્નન્સ ગ્રોસ રિટર્ન પ્રીમિયમ તથા નફાકારકતા પર આધારિત હોય છે. તાજેતરના તાજેતરમાં, આઇએજીએ તેના લિસ્ટિંગમાં રોકાણકારોએ અર્નિંગના ડાયલ-અપ વિકલ્પનો ઉપયોગ કર્યો ૩૦-૩૨ ગણાથી વધારે મલ્ટિપલ આપ્યા હતો જેનાથી તેમને આગામી બે વર્ષમાં અને ગ્રોસ રિટર્ન પ્રીમિયમના ત્રણ

મૂડીઝના અપગ્રેડ બાદ ટેક્નિકલ કારણો અને નકારાત્મક વૈશ્વિક સંકેતથી તેજી સામે અવરોધ

સ્વાતિ વર્મા ETMarkets.com

🔪 દીનોમિક્સને મડીઝના થમ્સઅપ બાદ **મ**િસર્જાયેલા ફીલ ગૂડ ફેક્ટર તેમજ વૈશ્વિક સંકેતોને ધ્યાનમાં લેતાં આ સપ્તાહે શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટની ધારણા છે. ગયા શુક્રવારે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ ભારતના રેટિંગમાં સુધારો કરીને મોદી સરકારના માળખાગત સુધારાને વધાવ્યા હતા, એજન્સીએ ભારતનું રેટિંગ Baa3થી સુધારીને Baa2 કર્યું હતું તેમજ રેટિંગ આઉટલૂક પોઝિટિવમાંથી સ્ટેબલ કર્યું હતું. આગામી સપ્તાહે પણ બજારમાં ભારતના સોવરિન રેટિંગમાં સુધારાની અસર જોવા મળે તેવી શક્યતા છે.

BSE સેન્સેક્સ શુક્રવારના ટ્રેડિંગના અંતે ૨૩૬ પોઇન્ટ વધીને ૩૩,૩૪૩ જ્યારે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૦,૩૦૦ની નજીક બંધ રહ્યો હતો. મુડીઝના રેટિંગ કરવો પડ્યો હતો અને અંતે તેને માત્ર અડધા ટકાના ચંદન તાપરિયાએ જણાવ્યું હતું. સધારાથી જ સંતોષ માનવો પડ્યો હતો. ઇન્ડેક્સ તેના



સુધારા બાદ નિક્ટીમાં ભારે કરંટ જોવા મળ્યો હતો ૧૦,૧૭૮ અને ૧૦,૧૨૦ નિક્ટીની મહત્ત્વની ટેકાની જ આ ફેરફાર અમલી બનશે.આ ઉપરાંત ફેડરલ પણ ૧૦,૩૪૦ની સપાટીએ તેને પ્રતિકારનો સામનો સપાટી છે, તેમ મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના

શુક્રવારે બજારનું ટ્રેડિંગ બંધ થયા બાદ S&P ડાઉ ઓપનિંગના સ્તર ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો ન જોન્સ અને BSEના જોઇન્ટ વેન્ચર એશિયા ઇન્ડેક્સે હતો અને ડેઇલી ચાર્ટમાં તેને નાની બેરીશ કેન્ડલ BSE સેન્સેક્સ કોમ્પોનન્ટમાં ફેરફાર કરીને સિપ્લા રચી હતી. આ સ્થિતિમાં નિક્ટી ૧૦,૨૩૦ની સપાટી અને લુપિનની બાદબાકી કરીને સેન્સેક્સના ૩૦ જાળવવામાં સફળ રહેશે તો તેમાં ૧૦,૩૫૦ અને શેરોની યાદીમાં ઇન્ડસઇન્ડ બેન્ક અને યસ બેન્કનો ૧૦,૪૦૦ની સપાટી જોવા મળી શકે છે. નીચામાં સમાવેશ કર્યો હતો. સોમવારે બજાર ખૂલશે ત્યારથી

૧૦,૪૦૦ની સપાટી જોવા મળી શકે છે બેન્ક, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, વક્રરાંગી અને બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સને BSE100 ઇન્ડેક્સમાં સામેલ કરવામા આવ્યા હતા. આ સ્થિતિમાં સોમવારે

બજારની ચાલને અસર

સેન્સેક્સમાંથી લુપિન અને સિપ્લાની

બાદબાકી તથા ઇન્ડસઇન્ડ બેન્ક અને

ચસ બેન્કના સમાવેશથી આ શેરોમાં

આંતરરાષ્ટ્રીય ભાવમાં શુક્રવારે બે

टडानो सुधारो थयो होवाथी तेनी

૧૦,૨૩૦ની સપાટી જાળવવામાં

સફળ રહેશે તો તેમાં ૧૦,૩૫૦ અને

બજારને હકારાત્મક અસર થઈ શકે છે.

કેન્ડલ બની હતી. આ સ્થિતિમાં નિફ્ટી

કરતાં મુખ્ય પરિબળો

तेनी प्रतिडिया श्रेवा भणशे

ગયા શુક્રવારે મૂડીઝે ભારતીય ટેલિકોમ ઓપરેટર Rcomને બોન્ડના વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટર થઈ હોવાનું જણાવીને તેનું ક્રેડિટ રેટિંગ પરત ખેંચી

જ્યારે શેરબજાર ખલશે ત્યારે આ તમામ શેરોમાં આ

ફેરફારની અસર જોવા મળે તેવી શક્યતા છે.

લેતાં મુશ્કેલીમાં સપડાયેલી આ કંપનીનો પડતા પર પાટુ જેવો ઘાટ થયો હતો. ગયા સપ્તાહે કંપનીએ સતત ચોથા ક્વાર્ટરમાં ખોટ નોંધાવી હતી અને બોન્ડનું વ્યાજ ચુકવવામાં નિષ્ફળ રહેવાને કારણે કંપનીના શેરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું, આ સપ્તાહે પણ કંપનીના શેરમાં વધુ ધોવાણની શક્યતા નકારી શકાય નહીં. વિશ્વભરનાં બજારો ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ પર નજર રાખી રહ્યા છે. સાઉદી અરેબિયામાં તણાવથી ક્રુડના ભાવમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. સતત પાંચ દિવસ બાદ ક્રૂડના ભાવમાં શુક્રવારે બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યા બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગયા સપ્તાહના અંતે ૬૫.૦૧ની સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો. રૂપિયાની વધઘટ દેશની આઇટી કંપનીઓના શેર્સ પર અસર કરી શકે તેમ છે તે જોતા રૂપિયાની ચાલ પર પણ રોકાણકારોની ચાંપતી નજર રહેશે.

સરકારે ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટી વધારીને દાયકાની ઊંચી સપાટીએ લાવી દીધી છે. ખાઘ તેલનું સૌથી મોટું આયાતકાર ભારતે તેના ખેડૂતોને સમર્થન આપવા માટે ડ્યૂટી વધારી છે. આ નિર્ણયથી તેલીબિયાંની કિંમતો વધશે અને સ્થાનિક બજારમાં પીલાણ માટે વધુ જથ્થો ઉપલબ્ધ બનશે અને તેનાથી દેશને ખાદ્ય તેલની આયાત નિયંત્રણમાં મદદ મળશે. સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની આયાત ડ્યૂટી વધારીને ૩૦ ટકા જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યૂટી ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી છે.

કંપની પરિણામ

મેટ્રિમોનિડોટકોમનો સંગઠિત ચોંપ્ર્ખો નફો 64 ટકા ઊછળ્યો

ચેન્નાઈ: ઓનલાઇન મેટ્રિમોનિયલ પોર્ટલ Matrimony.comએ ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં ૬૩.૮ ટકાના ઉછાળા સાથે ₹૧૯.૧૬૩ કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ આગલા નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹૧૧.૬૯૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પૂરા થયેલા છમાસિક ગાળામાં ૬૨ ટકાના ઉછાળા સાથે ₹૩૪.૦૪૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉ સમાન ગાળા માટે ₹૨૧.૦૧૩ કરોડ હતો. કંપનીની કુલ આવક વધીને ₹૮૩.૬૭૩ કરોડ નોંધાઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹૭૩.૬૧૩ કરોડ હતી. છમાસિક ગાળા માટે કંપનીની કુલ આવક વધીને ₹૧૬૭.૫૨૩ કરોડ હતી જે એક વર્ષ અગાઉ ₹૧૪૪.૯૮૩ કરોડ હતી. શુક્રવારે બીએસઇ પર કંપનીનો શેર ૦.૫૮ ટકા સુધરીને છેલ્લે ₹૮૬૪.૩૦ બંધ નોંધાયો હતો.

нмт ફરી નફો કરતી થઈ: ચોખ્ખો નફો ₹59 લાખ નોંધાચો

નવી દિલ્હી: સરકારની માલિકીની કંપની એચએમટી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના ૩૦ સપ્ટેમ્બરે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી ઊંચી આવક વચ્ચે ₹૫૯ લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹૨૮.૮૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ચાલુ નાશાકીય વર્ષના સમીક્ષા હેઠળના ગાળા માટે બેંગલુરુ સ્થિત મેન્યુફ્રેક્ચરિંગ કંપનીની કુલ આવક વધીને ₹€.૨૧ કરોડ હતી જે એક વર્ષ અગાઉ ₹૪.૫૯ કરોડ હતી. સમીક્ષા હેઠળના ગાળા માટે કંપનીનો કુલ ખર્ચ ઘટીને ₹૫.૨૬ કરોડ નોંધાયો હતો જે એક વર્ષ અગાઉના સમાન ગાળા માટે ₹૫.૭૮ કરોડ નોંધાયો હતો. આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય કેબિનેટના નિર્ણય અનુસાર કંપનીના ટ્રેકટર બિઝનેસને અલગ કરાયો છે. શુક્રવારે બીએસઇ પર કંપનીનો શેર ૧.૪૪ ટકા ઘટીને છેલ્લે ₹૪૦.૯૫ બંધ નોંધાયો હતો.

ADF

ADF Foods Limited

સીઆઇએનઃ L15400GJ1990PLC014265 **રજિસ્ટર્ડ ઓફિસઃ** ૮૩/૮૬ જીઆઇડીસી ઔદ્યોગિક વસાહત, નડિયાદ ૩૮૭૦૦૧, ગુજરાત **ટેલીકોનઃ** ૦૨૬૮-૨૫૫૧૩૮૧/૨, **ફેક્સઃ** ૦૨૬૮-૨૫૬૫૦૬૮; ઇ-મેઇલ: info@adf-foods.com; વેબસાઇટ: www.adf-foods.com

સેબી વિનિયમ, ૨૦૧૫ (લિસ્ટિંગ ફરજો અને જાહેરાત જરૂરીયાતો) ના વિનિયમ ૪૭ વંચાણે લીધા સાથે વિનિયમ ૨૯ ના અનુષંગે અત્રે નોટીસ આપવામાં આવે છે કે બીજી બાબતોની સાથોસાથ, બીજા ત્રૈમાસિક તેમ જ ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ રોજે સમાપ્ત થતા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીના ઑડિટ ન થયેલ નાણાકીય પરિણામો પર વિચારવિમર્શ તથા મંજૂર કરવા માટે કંપનીના નિયામક મંડળની એક સભા મુંબઇમાં મંગલવાર, ૨૮ મી નવેમ્બર, ૨૦૧૭ રોજે સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે.

સદર નોટીસ કંપનીની વેબસાઇટ www.adf-foods.com અને બીએસઇની વેબસાઇટ www.bseindia.com અને એનએસઇની વેબસાઇટ www.nseindia.com પર જોઇ શકાશે.

એડીએફ ફૂડ્સ લિમટિડ વતી બિમલ આર ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર ડીઆઇએનઃ ૦૦૦૮૭૪૦૪

ઠડુ પાણી ફરવ્યુ

ક્રૂડ ઓઇલમાં છ સપ્તાહમાં પ્રથમ વખત પીછેહટ જોવા મળી હતી. ભૂ-રાજકીય જોખમો ઘટ્યાં હોવાથી હવે ટ્રેડરો માગ-પુરવઠાના ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમેરિકામાં વિક્રમ ઉત્પાદન, સતત બીજા સપ્તાહે સ્ટોકમાં વધારો અને વૈશ્વિક પુરવઠાના અંદાજમાં IEAના ઘટાડાથી એવી ચિંતા ઉભી થઈ છે કે એોપેક અને નોન ઓપેક ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં વધુ કાપથી પણ ઓઇલ માર્કેટમાં પુનઃસંતુલન લાવવામાં મદદ મળશે નહીં.

ગયા મહિને ઓઇલ ટ્રેડરોને પુનઃસંતુલનના પ્રયાસોથી વિશ્વાસ મળ્યો હતો, કારણ કે ઓઇલ દેશોએ નિર્ણયનું અસરકારક પાલન કર્યું હતું અને આગામી વર્ષના અંત સુધી ઉત્પાદનમાં કાપને લંબાવવામાં આવે તેવી ઊંચી શક્યતા હતી. તેનાથી બ્રેન્ટ ફ્રૂડ બેરલ દીઠ ૬૫ ડોલર અને WTI ફ્રૂડ ૫૮ ડોલરની નજીક પહોંચ્યું હતું. ગયા સોમવારે ઓપેકે બજારમાં વધુ ઉત્સાહ આણ્યો હતો. ઓપેકે જાહેર કરેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના સભ્યો ઉત્પાદન કાપના નિર્ણયનું ચુસ્ત પાલન કરી રહ્યા છે અને

ઓપેકના દેશોએ ઓક્ટોબરમાં ઉત્પાદનમાં કુલ પ્રતિદિન ૧૫૧,૦૦૦ બેરલનો ઘટાડો થયો હતો. ઓપેકના સેક્રેટરી જનરલ મોહંમદ બાર્કિન્ડોએ જણાવ્યું હતું ઉત્પાદન કાપના સમયમાં વધારો આ કાર્ટેલની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવાનો 'એકમાત્ર દેખીતો વિકલ્પ' છે. જોકે IEAએ મંગળવારે બુલિશ સેન્ટિમેન્ટ પર પાણી ફેરવ્યું હતું. તેને ચેતવણી આપી હતી કે બેરલ દીઠ ૬૦ ડોલરનો નવો ઊંચો ભાવ નથી. તેના બેરિશ ડેટામાં 4Q2017 માટે ક્રૂડની માગના અંદાજમાં પ્રતિદિન ૩,૧૧,૦૦૦ બેરલના ઘટાડાનો



કોમોડિટી કારોબાર

પણ સમાવેશ થાય છે. ક્રૂડની અપેક્ષા કરતાં ઓછી માગનું એક કારણ ભાવમાં સપ્ટેમ્બર પછીથી આશરે ૨૦ ટકાનો વધારો છે.

યુએસ શેલ અને બીજા નોન ઓપેક ઉત્પાદન ૨૦૧૮માં નવા સપ્લાયમાં ૧.૪ mb/dનો જંગી ઉમેરો કરશે, જેનાથી ઓપેકના પ્રયાસો લગભગ અસરહીન થઈ જશે. IEAએ જણાવ્યું હતું કે ફ્રૂડ ઓઇલની માગ સપ્લાયમાં આ જંગી વધારા સાથે તાલ મિલાવવા મુશ્કેલી અનુભવશે. IEAએ જણાવ્યું હતું કે યુએસ શેલ સપ્લાયમાં આગામી દાયકામાં મજબૂત વધારો થશે. તેનાથી આગામી દાયકામાં વૈશ્વિક ઓઇલ ઉત્પાદકોમાં અમેરિકા નિર્વિવાદ લીડર બનશે. લાંબા ગાળામાં જોઈએ તો શેલ ગેસનું ઉત્પાદન ૨૦૨૫ સુધીમાં નવ mb/d થશે, જે અંદાજમાં ૩૪ ટકાનો વધારો દર્શાવે છે. IEAએ વધુમાં જણાવ્યું હતું કે ભૂ-રાજકીય પ્રીમિયમના અભાવની ધારણા રાખીએ તો ફૂડ ઓઇલના ભાવ માટે ન્યૂ નોર્મલ જોવા ન મળે તેવી શક્યતા છે, જે સંકેત આપે છે કે તાજેતરની તેજી ટૂંકા ગાળા માટેની બની શકે છે.

મુંબઈ

૨૦ નવેમ્બર, ૨૦૧૭

न्यु ग्रुप सुपर ऐन्यएशन केश ऐक्युम्युलेशन प्लान

UIN: 512N274VO2



नियोक्ता खुश

कर्मचारी भी



प्रमुख विशेषताएँ

- सुनिश्चित लाभ और सुनिश्चित अंशदान के लिए आदर्श योजना
- कर्मचारियों के अंशदान हेत् भी विकल्प
- आयकर अधिनियम के वर्तमान प्रावधान की धारा 36(1) (iv) और 10(25) (iii) के तहत कर मे राहत
- ब्याज दर की गारंटी
- भुगतान के सरल विकल्प

भ्रामक फोन कॉल्स तथा फर्जी/धोखाधड़ी वाली ऑफर्स से सावधान आईआरडीएआई सर्वसाधारण को सूचित करता है • **आईआरडीएआई या इसके अधिकारी, बीमा विक्रय या वित्तीय उत्पाद अथवा** प्रीमियम निवेश संबंधी गतिविधियों से संबंध नहीं रखते • आईआरडीएआई किसी प्रकार के बोनस की घोषणा नहीं करता , ऐसे फोन आने पर कॉल विवरण तथा फोन नंबर की रिपोर्ट तुरंत पुलिस में दर्ज करवायें

एल आई सी की समृह योजनाओं से प्रतिभावान लोगों को आकर्षित करें तथा अपने साथ बनाये रखें| विस्तृत जानकारी के लिए ई मेल करें : groupbusiness@licindia.com

आईआरडीएआई पंजीकरण संख्या 512 Follow us : 1 You 1 E LIC India Forever

भारतीय जीवन बीमा निगम www.licindia.in

बिक्री के समापन से पूर्व कृपया विस्तृत जानकारी के लिए बिक्री पुस्तिका को ध्यानपूर्वक पढ़ें।

નક્કર વૃદ્ધિ સાથે અમરા રાજામાં | રોકાણકારોનો રસ વધ્યો

સાતત્થ અને મજબૂત ઓપરેટિંગ માર્જિન નોંધાવ્યા બાદ રસ વધ્યો છે. 🌬

દેશની બીજા ક્રમની સૌથી મોટી બેટરી ઉત્પાદક અમરા રાજાએ વોલ્યુમ ગ્રોથમાં

સેન્સેક્સમાં બેન્ક શેરોનું વેઇટેજ વધશે

બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં આગામી મહિનાથી થનારા ફેરફારની સીધી અસર સેન્સેક્સ પર વધતી જશે. >>10



બજારમાં તેજીનો ટ્રેન્ડ મર્ચાદિત રહેવાની ધારણા

Elgie S તેજી-મંદીની આંટીઘૂંટી

વધારીને Baa2 કર્યું હતું. રેટિંગમાં મજબૂત છે. વધારો ૧૪ વર્ષ બાદ થયો છે, જેનાથી ૧૦ વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ ૧૦ બેસિસ પોઇન્ટ્સ ગબડી હતી.

નિફ્ટી ૧૦,૨૫૦થી ઉપર ૧૦,૨૮૩એ બંધ આવ્યો હતો, જે પોઝિટિવ છે, પરંતુ ટેક્નિકલ કારણો અને નકારાત્મક વૈશ્વિક સંકેતને તેની શક્યતા મર્યાદિત છે. નિફ્ટીમાં ગેસોલિન સ્ટોક અને યુએસ FO-૧૦,૨૫૬ અને ૧૦,૧૨૧એ સપોર્ટ MCની કાર્યનોંધનો સમાવેશ થાય છે. છે. આ બંને સ્તરથી નીચે જશે તો તે ક્રૂડ ઓઇલમાં પોઝિટિવ વલણ ૧૦,૦૦૦થી નીચે જઈ શકે છે.

અને ૨૩,૫૯૯એ અવરોધ છે. તેનાથી અને ૫૪.૨૬ ડોલરે સપોર્ટ છે. નીચે કે ઊંચે જશે તો તે બજારની દિશા બોન્ડની યીલ્ડમાં ઘટાડો અને સાવચેતી રાખવી જોઈએ.

છે, તેમાં તેજીનું આઉટલૂક છે, પરંતુ અપસાઇડ મર્યાદિત લાગે છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ઓવરબોટ છે, તેથી આપશે તીવ્ર અપસાઇડની એક આશ્ચર્યજનક હિલચાલમાં અપેક્ષા રાખવી જોઈએ નહીં. જોકે વૈશ્વિક રેટિંગ એજન્સી મુડીઝે નિક્ટી પ્રાઇવેટ સેક્ટર બેન્ક ઇન્ડેક્સ ભારતના સોવરિને રેટિંગને Baa3થી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ કરતાં વધુ

અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઇક્વિટી અને બોન્ડ માર્કેટ્સમાં વધુ મજબતાઈને કારણે આઇટી અને વિદેશી નાણાપ્રવાહ આવી શકે છે. ફાર્મા ઇન્ડેક્સમાં વધુ ઘટાડો થઈ શકે શુક્રવારે રેટિંગ અપગ્રેડ બાદ નિક્ટી છે. તેથી આ બંને ક્ષેત્રોના શેરો અને અને સેન્સેક્સ બંને ગેપ-અપમાં ખૂલ્યા મેટલ શેરોથી દૂર રહેવું વધુ યોગ્ય છે. હતા, પરંતુ વૈશ્વિક બજારના નેગેટિવ ગયા સપ્તાહે મેટલ શેરોમાં કરેક્શન સંકેતને કારણે મોટા ભાગનો ઉછાળો આવ્યું હતું, પરંતુ ઓવરસોલ્ડ ધોવાઈ ગયો હતો. ભારતનો રૂપિયો પોઝિશનને કારણે શુક્રવારે કરેક્શન પણ મજબૂત સ્તરે ખૂલ્યો હતો અને આવ્યું હતું. મુખ્ય ટેક્નિકલ ઇન્ડિકેટર્સ હજુ નબળા છે, તેથી માત્ર

> એલેક્સ મેથ્યુ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ, સ્થાપક nedailybrunch.com

પસંદગીના શેરો બજારમાં

સારો દેખાવ કરી શકે છે. ભારતના બજાર માટેના કારણે અપસાઇડ મર્યાદિત છે. મુખ્ય આર્થિક ડેટામાં બેન્ક લોન નિફ્ટીમાં તાકીદનો અવરોધ ૧૦,૩૪૧ ગ્રોથ, ડિપોઝિટ ગ્રોથ અને વિદેશી અને ૧૦,૩૯૦એ છે. જો આ સપ્તાહે હુંડિયામણની અનામતનો સમાવેશ આ બંને સપાટી વટાવી જશે તો તે થાય છે. અમેરિકાના બજાર માટેના ૧૦,૪૯૨ને સ્પર્શ કરી શકે છે, પરંતુ મુખ્ય આર્થિક ડેટામાં જોબલેસ ક્લેમ,

છે, પરંતુ ઇરાક અને તુર્કીએ નિકાસ અમેરિકામાં સૌથી મોટું જોખમ કરવાનો નિર્ણય કર્યા બાદ ગુરુવારે બોન્ડમાં તીવ્ર ઘટાડો છે, જેને ઇક્વિટી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. માર્કેટમાં ટેક્નિકલ કરેક્શનનો ટેક્નિકલ દેષ્ટિએ જોઈએ તો ક્રૂડ પ્રારંભિક સંકેત માનવામાં આવે છે. ડાઉ ઓઇલ બેરલ દીઠ ૫૮ ડોલર થઈ શકે જોન્સમાં ૨૩,૨૬૪એ મજબૂત સપોર્ટ છે. તેમાં બેરલ દીઠ ૫૫.૦૪ ડોલર

આપી શકે છે. ડાઉ જોન્સનો મન્થલી આગામી મહિને ફેડરલ રિઝર્વની આરએસઆઇ ૮૦થી ઉપર છે, તેથી બેઠક પહેલાં ડોલરમાં નરમાઈને ઊંચા સ્તરે લોંગ પોઝિશન લેતી વખતે કારણે સોનામાં ફરી પોઝિટિવ વલણ છે. સોનામાં ઔંસ દીઠ ૧,૨૭૮ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં ૨૫,૩૬૮એ અને ૧,૨૬૮ ડોલરે સપોર્ટ છે. તેમાં સપોર્ટ અને ૨૬,૦૦૯એ અવરોધ ૧,૩૦૫એ અવરોધ છે.

સ્પષ્ટતાઃ આ કોલમમાં થતી આર્થિક સમીક્ષા, બજાર વિશ્લેષણ અને શેર સમીક્ષા સબધિત બજાર વિશ્લેષક દ્વારા શેરબજાર અગે પ્રાપ્ય માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે. બજારમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારે રોકાણનો કોઈ पण निर्णय पोतानी समक्षण अने निष्णांतना मार्गदर्शनने आधारे हरवानो રહેશે. રોકાણકારને પોતાના નિર્ણયથી થનારા લાભ કે નુકસાન માટે ઇકોનોમિક ટાઇમ્સ અને લેખક/એનાલિસ્ટ કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.

SBI જનરલના 18થી 24 મહિનામાં લિસ્ટિંગની હિલચાલ

શિલ્પી સિંહા મુંબઈ

સરકાર જાહેર ક્ષેત્રની બેન્કો માટે રિકેપિટલાઇઝેશન યોજના તૈયાર કરી રહી છે ત્યારે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના મૂડીઆધારને સુધારવા માટે આગામી ૧૮થી ૨૪ મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયન જૂથ (આઇએજી) સાથેના સંયુક્ત સાહસ એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સનું લિસ્ટિંગ કરાવવા માટે વિચારી શકે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેની જનરલ સંયુક્ત સાહસના એમઓયુમાં દર્શાવ્યા ઇન્શ્યોરન્સ પેટાકંપનીમાં ૨૦ ટકા અનુસાર ચોક્કસ સમય મર્યાદાની અંદર હિસ્સાનું વેચાણ કરીને ₹૨,૫૦૦ કરોડ કોલની કવાયત કરવાનો અધિકાર છે, એકત્ર કરી શકે. તેણે પોતાની જીવન જેને આઇએજીએ કેટલાક મહિના અગાઉ વીમા પેટાકંપની એસબીઆઇ લાઇફમાં પાર પાડ્યો હતો. તેનો આઠ ટકા હિસ્સો વેચીને ₹૫,૬૦૦ ₹૬૫,૯૭૫ કરોડ મુકાયું છે.

અને દેખાવમાં સુધારામાં પરિણમશે.

તેમનો હિસ્સો ૪૯ ટકા સુધી લઈ જવાની ગણાએ છે.



હાલના દેખાવના આધારે જોઈએ તો તક મળે છે. ડાયલ-અપ ઓપ્શને તેના

સંયુક્ત સાહસમાં પ્રવેશ કરતી કરોડ એકત્ર કર્યા છે. કંપનીનું મૂલ્ય વખતે આઇએજીએ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં એસબીઆઇના ભાગીદાર એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સના બનવા માટે ૨૬ ટકા હિસ્સો હસ્તગત એમડી અને સીઇઓ પુશન મહાપાત્રાએ કરવા માટે ₹૫૪૨ કરોડ ચૂકવ્યા જણાવ્યું હતું કે, લિસ્ટિંગ મૂડીની હતા. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરી આઇએજીનો હિસ્સો વધીને ૪૯ ટકા શકે કેમ કે અમે ઝડપી ગતિએ વૃદ્ધિ થાય તો આઇપીઓ મારફત હિસ્સાનું કરી રહ્યા છીએ. તે શેરહોલ્ડર્સને તેમના વેચાણ સપ્રમાણ ભાગમાં થશે. જનરલ રોકાશનાં નાશાં મેળવવામાં મદદ કરશે ઇન્શ્યોરન્સ કંપનીઓનું વેલ્યુએશન તથા વધારે સારા ડિસ્ક્લોઝર, ગવર્નન્સ ગ્રોસ રિટર્ન પ્રીમિયમ તથા નફાકારકતા પર આધારિત હોય છે. તાજેતરના તાજેતરમાં, આઇએજીએ તેના લિસ્ટિંગમાં રોકાણકારોએ અર્નિંગના ડાયલ-અપ વિકલ્પનો ઉપયોગ કર્યો ૩૦-૩૨ ગણાથી વધારે મલ્ટિપલ આપ્યા હતો જેનાથી તેમને આગામી બે વર્ષમાં અને ગ્રોસ રિટર્ન પ્રીમિયમના ત્રણ

મૂડીઝના અપગ્રેડ બાદ ટેક્નિકલ કારણો અને નકારાત્મક વૈશ્વિક સંકેતથી તેજી સામે અવરોધ

સ્વાતિ વર્મા ETMarkets.com

🔪 દીનોમિક્સને મડીઝના થમ્સઅપ બાદ **મ**િસર્જાયેલા ફીલ ગૂડ ફેક્ટર તેમજ વૈશ્વિક સંકેતોને ધ્યાનમાં લેતાં આ સપ્તાહે શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટની ધારણા છે. ગયા શુક્રવારે ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ ભારતના રેટિંગમાં સુધારો કરીને મોદી સરકારના માળખાગત સુધારાને વધાવ્યા હતા, એજન્સીએ ભારતનું રેટિંગ Baa3થી સુધારીને Baa2 કર્યું હતું તેમજ રેટિંગ આઉટલૂક પોઝિટિવમાંથી સ્ટેબલ કર્યું હતું. આગામી સપ્તાહે પણ બજારમાં ભારતના સોવરિન રેટિંગમાં સુધારાની અસર જોવા મળે તેવી શક્યતા છે.

BSE સેન્સેક્સ શુક્રવારના ટ્રેડિંગના અંતે ૨૩૬ પોઇન્ટ વધીને ૩૩,૩૪૩ જ્યારે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૦,૩૦૦ની નજીક બંધ રહ્યો હતો. મુડીઝના રેટિંગ કરવો પડ્યો હતો અને અંતે તેને માત્ર અડધા ટકાના ચંદન તાપરિયાએ જણાવ્યું હતું. સધારાથી જ સંતોષ માનવો પડ્યો હતો. ઇન્ડેક્સ તેના

સુધારા બાદ નિફ્ટીમાં ભારે કરટ જોવા મળ્યો હતો. ૧૦,૧૭૮ અને ૧૦,૧૨૦ નિફ્ટીની મહત્ત્વની ટેકાની જ આ ફેરફાર અમલી બનશે.આ ઉપરાંત ફેડરલ પણ ૧૦,૩૪૦ની સપાટીએ તેને પ્રતિકારનો સામનો સપાટી છે, તેમ મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના

શુક્રવારે બજારનું ટ્રેડિંગ બંધ થયા બાદ S&P ડાઉ ઓપનિંગના સ્તર ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો ન જોન્સ અને BSEના જોઇન્ટ વેન્ચર એશિયા ઇન્ડેક્સે હતો અને ડેઇલી ચાર્ટમાં તેને નાની બેરીશ કેન્ડલ BSE સેન્સેક્સ કોમ્પોનન્ટમાં ફેરફાર કરીને સિપ્લા રચી હતી. આ સ્થિતિમાં નિક્ટી ૧૦,૨૩૦ની સપાટી અને લુપિનની બાદબાકી કરીને સેન્સેક્સના ૩૦ જાળવવામાં સફળ રહેશે તો તેમાં ૧૦,૩૫૦ અને શેરોની યાદીમાં ઇન્ડસઇન્ડ બેન્ક અને યસ બેન્કનો ૧૦,૪૦૦ની સપાટી જોવા મળી શકે છે. નીચામાં સમાવેશ કર્યો હતો. સોમવારે બજાર ખૂલશે ત્યારથી

કરતાં મુખ્ય પરિબળો સેન્સેક્સમાંથી લુપિન અને સિપ્લાની બાદબાકી તથા ઇન્ડસઇન્ડ બેન્ક અને

બજારની ચાલને અસર

ચસ બેન્કના સમાવેશથી આ શેરોમાં तेनी प्रतिडिया श्रेवा भणशे 🕨 સતત પાંચ દિવસ બાદ ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં શુક્રવારે બે टडानो सुधारो थयो होवाथी तेनी

▶ નિક્ટીના ડેઇલી ચાર્ટમાં નાની બેરીશ કેન્ડલ બની હતી. આ સ્થિતિમાં નિફ્ટી ૧૦,૨૩૦ની સપાટી જાળવવામાં સફળ રહેશે તો તેમાં ૧૦,૩૫૦ અને ૧૦,૪૦૦ની સપાટી જોવા મળી શકે છે

બજારને હકારાત્મક અસર થઈ શકે છે.

બેન્ક, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, વક્રરાંગી અને બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સને BSE100 ઇન્ડેક્સમાં સામેલ કરવામા આવ્યા હતા. આ સ્થિતિમાં સોમવારે જ્યારે શેરબજાર ખલશે ત્યારે આ તમામ શેરોમાં આ ફેરફારની અસર જોવા મળે તેવી શક્યતા છે.

ગયા શુક્રવારે મૂડીઝે ભારતીય ટેલિકોમ ઓપરેટર Rcomને બોન્ડના વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટર થઈ હોવાનું જણાવીને તેનું ક્રેડિટ રેટિંગ પરત ખેંચી

લેતાં મશ્કેલીમાં સપડાયેલી આ કંપનીનો પડતા પર પાટુ જેવો ઘાટ થયો હતો. ગયા સપ્તાહે કંપનીએ સતત ચોથા ક્વાર્ટરમાં ખોટ નોંધાવી હતી અને બોન્ડનું વ્યાજ ચુકવવામાં નિષ્ફળ રહેવાને કારણે કંપનીના શેરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું, આ સપ્તાહે પણ કંપનીના શેરમાં વધુ ધોવાણની શક્યતા નકારી શકાય નહીં. વિશ્વભરનાં બજારો ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ પર નજર રાખી રહ્યા છે. સાઉદી અરેબિયામાં તણાવથી ક્રુડના ભાવમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. સતત પાંચ દિવસ બાદ ક્રૂડના ભાવમાં શુક્રવારે બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યા બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગયા સપ્તાહના અંતે ૬૫.૦૧ની સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો. રૂપિયાની વધઘટ દેશની આઇટી કંપનીઓના શેર્સ પર અસર કરી શકે તેમ છે તે જોતા રૂપિયાની ચાલ પર પણ રોકાણકારોની ચાંપતી નજર રહેશે.

સરકારે ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટી વધારીને દાયકાની ઊંચી સપાટીએ લાવી દીધી છે. ખાઘ તેલનું સૌથી મોટું આયાતકાર ભારતે તેના ખેડૂતોને સમર્થન આપવા માટે ડ્યૂટી વધારી છે. આ નિર્ણયથી તેલીબિયાંની કિંમતો વધશે અને સ્થાનિક બજારમાં પીલાણ માટે વધુ જથ્થો ઉપલબ્ધ બનશે અને તેનાથી દેશને ખાદ્ય તેલની આયાત નિયંત્રણમાં મદદ મળશે. સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની આયાત ડ્યૂટી વધારીને ૩૦ ટકા જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યુટી ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી છે.

કંપની પરિણામ

મેટ્રિમોનિડોટકોમનો સંગઠિત ચોપ્ખો નફો 64 ટકા ઊછળ્યો

ચેન્નાઈ: ઓનલાઇન મેટ્રિમોનિયલ પોર્ટલ Matrimony.comએ ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં ૬૩.૮ ટકાના ઉછાળા સાથે ₹૧૯.૧૬૩ કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ આગલા નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹૧૧.૬૯૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પૂરા થયેલા છમાસિક ગાળામાં ૬૨ ટકાના ઉછાળા સાથે ₹૩૪.૦૪૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉ સમાન ગાળા માટે ₹૨૧.૦૧૩ કરોડ હતો. કંપનીની કુલ આવક વધીને ₹૮૩.૬૭૩ કરોડ નોંધાઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹૭૩.૬૧૩ કરોડ હતી. છમાસિક ગાળા માટે કંપનીની કુલ આવક વધીને ₹૧૬૭.૫૨૩ કરોડ હતી જે એક વર્ષ અગાઉ ₹૧૪૪.૯૮૩ કરોડ હતી. શુક્રવારે બીએસઇ પર કંપનીનો શેર ૦.૫૮ ટકા સુધરીને છેલ્લે ₹૮૬૪.૩૦ બંધ નોંધાયો હતો.

нмт ફરી નફો કરતી થઈ: ચોખ્ખો નફો ₹59 લાખ નોંધાચો

નવી દિલ્હી: સરકારની માલિકીની કંપની એચએમટી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના ૩૦ સપ્ટેમ્બરે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી ઊંચી આવક વચ્ચે ₹૫૯ લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹૨૮.૮૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ચાલુ નાશાકીય વર્ષના સમીક્ષા હેઠળના ગાળા માટે બેંગલુરુ સ્થિત મેન્યુફ્રેક્ચરિંગ કંપનીની કુલ આવક વધીને ₹€.૨૧ કરોડ હતી જે એક વર્ષ અગાઉ ₹૪.૫૯ કરોડ હતી. સમીક્ષા હેઠળના ગાળા માટે કંપનીનો કુલ ખર્ચ ઘટીને ₹૫.૨૬ કરોડ નોંધાયો હતો જે એક વર્ષ અગાઉના સમાન ગાળા માટે ₹૫.૭૮ કરોડ નોંધાયો હતો. આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય કેબિનેટના નિર્ણય અનુસાર કંપનીના ટ્રેકટર બિઝનેસને અલગ કરાયો છે. શુક્રવારે બીએસઇ પર કંપનીનો શેર ૧.૪૪ ટકા ઘટીને છેલ્લે ₹૪૦.૯૫ બંધ નોંધાયો હતો.

ADF **ADF Foods Limited**

સીઆઇએનઃ L15400GJ1990PLC014265 **રજિસ્ટર્ડ ઓફિસઃ** ૮૩/૮૬ જીઆઇડીસી ઔદ્યોગિક વસાહત, નડિયાદ ૩૮૭૦૦૧, ગુજરાત **ટેલીકોનઃ** ૦૨૬૮-૨૫૫૧૩૮૧/૨, **ફેક્સઃ** ૦૨૬૮-૨૫૬૫૦૬૮; ઇ-મેઇલ: info@adf-foods.com; વેબસાઇટ: www.adf-foods.com

સેબી વિનિયમ, ૨૦૧૫ (લિસ્ટિંગ ફરજો અને જાહેરાત જરૂરીયાતો) ના વિનિયમ ૪૭ વંચાણે લીધા સાથે વિનિયમ ૨૯ ના અનુષંગે અત્રે નોટીસ આપવામાં આવે છે કે બીજી બાબતોની સાથોસાથ, બીજા ત્રૈમાસિક તેમ જ ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ રોજે સમાપ્ત થતા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીના ઑડિટ ન થયેલ નાણાકીય પરિણામો પર વિચારવિમર્શ તથા મંજૂર કરવા માટે કંપનીના નિયામક મંડળની એક સભા મુંબઇમાં મંગલવાર, ૨૮ મી નવેમ્બર, ૨૦૧૭ રોજે સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે. સદર નોટીસ કંપનીની વેબસાઇટ www.adf-foods.com અને બીએસઇની

વેબસાઇટ www.bseindia.com અને એનએસઇની વેબસાઇટ www.nseindia.com પર જોઇ શકાશે.

એડીએફ ફૂડ્સ લિમટિડ વતી બિમલ આર ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર ડીઆઇએનઃ ૦૦૦૮૭૪૦૪

ઠડુ પાણી ફરવ્યુ

ક્રૂડ ઓઇલમાં છ સપ્તાહમાં પ્રથમ વખત પીછેહટ જોવા મળી હતી. ભૂ-રાજકીય જોખમો ઘટ્યાં હોવાથી હવે ટ્રેડરો માગ-પુરવઠાના ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમેરિકામાં વિક્રમ ઉત્પાદન, સતત બીજા સપ્તાહે સ્ટોકમાં વધારો અને વૈશ્વિક પુરવઠાના અંદાજમાં IEAના ઘટાડાથી એવી ચિંતા ઉભી થઈ છે કે એોપેક અને નોન ઓપેક ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં વધુ કાપથી પણ ઓઇલ માર્કેટમાં પુનઃસંતુલન લાવવામાં મદદ મળશે નહીં.

ગયા મહિને ઓઇલ ટ્રેડરોને પુનઃસંતુલનના પ્રયાસોથી વિશ્વાસ મળ્યો હતો, કારણ કે ઓઇલ દેશોએ નિર્ણયનું અસરકારક પાલન કર્યું હતું અને આગામી વર્ષના અંત સુધી ઉત્પાદનમાં કાપને લંબાવવામાં આવે તેવી ઊંચી શક્યતા હતી. તેનાથી બ્રેન્ટ ફ્રૂડ બેરલ દીઠ ૬૫ ડોલર અને WTI ફ્રૂડ ૫૮ ડોલરની નજીક પહોંચ્યું હતું. ગયા સોમવારે ઓપેકે બજારમાં વધુ ઉત્સાહ આણ્યો હતો. ઓપેકે જાહેર કરેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના સભ્યો ઉત્પાદન કાપના નિર્ણયનું ચુસ્ત પાલન કરી રહ્યા છે અને

ઓપેકના દેશોએ ઓક્ટોબરમાં ઉત્પાદનમાં કુલ પ્રતિદિન ૧૫૧,૦૦૦ બેરલનો ઘટાડો થયો હતો. ઓપેકના સેક્રેટરી જનરલ મોહંમદ બાર્કિન્ડોએ જણાવ્યું હતું ઉત્પાદન કાપના સમયમાં વધારો આ કાર્ટેલની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવાનો 'એકમાત્ર દેખીતો વિકલ્પ' છે. જોકે IEAએ મંગળવારે બુલિશ સેન્ટિમેન્ટ પર પાણી ફેરવ્યું હતું. તેને ચેતવણી આપી હતી કે બેરલ દીઠ ૬૦ ડોલરનો નવો ઊંચો ભાવ નથી. તેના બેરિશ ડેટામાં 4Q2017 માટે ક્રૂડની માગના અંદાજમાં પ્રતિદિન



કોમોડિટી કારોબાર

૩,૧૧,૦૦૦ બેરલના ઘટાડાનો પણ સમાવેશ થાય છે. ક્રૂડની અપેક્ષા કરતાં ઓછી માગનું એક કારણ ભાવમાં સપ્ટેમ્બર પછીથી આશરે ૨૦ ટકાનો વધારો છે.

યુએસ શેલ અને બીજા નોન ઓપેક ઉત્પાદન ૨૦૧૮માં નવા સપ્લાયમાં ૧.૪ mb/dનો જંગી ઉમેરો કરશે, જેનાથી ઓપેકના પ્રયાસો લગભગ અસરહીન થઈ જશે. IEAએ જણાવ્યું હતું કે ફ્રૂડ ઓઇલની માગ સપ્લાયમાં આ જંગી વધારા સાથે તાલ મિલાવવા મુશ્કેલી અનુભવશે. IEAએ જણાવ્યું હતું કે યુએસ શેલ સપ્લાયમાં આગામી દાયકામાં મજબૂત વધારો થશે. તેનાથી આગામી દાયકામાં વૈશ્વિક ઓઇલ ઉત્પાદકોમાં અમેરિકા નિર્વિવાદ લીડર બનશે. લાંબા ગાળામાં જોઈએ તો શેલ ગેસનું ઉત્પાદન ૨૦૨૫ સુધીમાં નવ mb/d થશે, જે અંદાજમાં ૩૪ ટકાનો વધારો દર્શાવે છે. IEAએ વધુમાં જણાવ્યું હતું કે ભૂ-રાજકીય પ્રીમિયમના અભાવની ધારણા રાખીએ તો ફૂડ ઓઇલના ભાવ માટે ન્યૂ નોર્મલ જોવા ન મળે તેવી શક્યતા છે, જે સંકેત આપે છે કે તાજેતરની તેજી ટૂંકા ગાળા માટેની બની શકે છે.

न्यु ग्रुप सुपर ऐन्यएशन केश ऐक्युम्युलेशन प्लान

મુંબઈ

૨૦ નવેમ્બર, ૨૦૧૭

UIN: 512N274VO2



नियोक्ता खुश

कर्मचारी भी

प्रमुख विशेषताएँ

सुनिश्चित लाभ और सुनिश्चित अंशदान के लिए आदर्श योजना

कर्मचारियों के अंशदान हेत् भी विकल्प

आयकर अधिनियम के वर्तमान प्रावधान की धारा 36(1) (iv) और 10(25) (iii) के तहत कर मे राहत

ब्याज दर की गारंटी

भुगतान के सरल विकल्प

भ्रामक फोन कॉल्स तथा फर्जी/धोखाधड़ी वाली ऑफर्स से सावधान आईआरडीएआई सर्वसाधारण को सूचित करता है • **आईआरडीएआई या इसके अधिकारी, बीमा विक्रय या वित्तीय उत्पाद अथवा** प्रीमियम निवेश संबंधी गतिविधियों से संबंध नहीं रखते • आईआरडीएआई किसी प्रकार के बोनस की घोषणा नहीं करता , ऐसे फोन आने पर कॉल विवरण तथा फोन नंबर की रिपोर्ट तुरंत पुलिस में दर्ज करवायें

एल आई सी की समृह योजनाओं से प्रतिभावान लोगों को आकर्षित करें तथा अपने साथ बनाये रखें|

विस्तृत जानकारी के लिए ई मेल करें : groupbusiness@licindia.com Follow us : 1 You 1 E LIC India Forever

आईआरडीएआई पंजीकरण संख्या 512

भारतीय जीवन बीमा निगम www.licindia.in

बिक्री के समापन से पूर्व कृपया विस्तृत जानकारी के लिए बिक्री पुस्तिका को ध्यानपूर्वक पढ़ें।